



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

તા.૦૪/૧૦/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૩૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૬ કેસ કરી, ૪૧ વ્યક્તિઓને ઝડપી, ૧૪૭ લીટર દેશી દારૂ, ૩૩૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ સ્ફૂટર અને ૧ રીક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૮,૨૯૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૯૩૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૯ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપિંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૯૩૮/૧૮

સોલા હાઈકોર્ટ: ગોપીરાજ રજનીકાંત બ્રહ્મભટ્ટ (રહે. કાલીન્દી બંગલો ગુલાબ ટાવર રોડ થલતેજ) એ તા.૩/૧૦/૧૮ નારોજ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૯/૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન સોલા કાર્ગીલ પેટ્રોલ પંપ પાસે આર્યગ્રાન્ડ ક્લબની બાજુમાં પામ ઝ્લોરી-૨ ખાતે આરોપી (૧) રાજેશભાઈ પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટ અને (૨) નીયાબેન રાજેશભાઈ બ્રહ્મભટ્ટ (બન્ને રહે. નિરાંત મહાલયા-૨ અનુરાગ બંગલો સાયન્સ સીટી રોડ સોલા) એ ભેગા મળી દુકાન વેચાણ આપવાનું નક્કી કરી તેની અવેજ પેટેના રૂપિયા ૨૯,૦૦,૦૦૦/- મેળવી લઈ દુકાનનો વેચાણ દસ્તાવેજ નહી કરી કે નાણાં પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.આર.રાહોડ યલાવે છે.

રામોલ: જીતુભાઈ રમેશભાઈ રાજપુત (રહે.હરભોળાનાથપાર્ક ને.હા.નં-૮ ઓઢવ) એ તા.૩/૧૦/૧૮ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૨/૦૬ થી તા.૦૩/૧૦/૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) અબ્બાસઅલી મહમદમીયા સૈયદ (૨) કુલશનબીબી હુસેનમીયા સૈયદ (૩) બીબીશાબ મહમદમીયા સૈયદ (૪) ઇકબાલબીબી મહમદમીયા સૈયદ (૫) સાજીદઅલી અબ્બાસઅલી સૈયદ (તમામ રહે. રામોલ) એ ભેગા મળી જમીન વેચાણ આપી રૂપિયા ૪૧,૫૬,૫૦૦/- મેળવી લઈ જમીનનો વેચાણ દસ્તાવેજ નહી કરી કે નાણાં પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી મનુભાઈ વીરાભાઈ યલાવે છે.

નિકોલ: દક્ષ શૈલેષભાઈ પટેલ (રહે. સરીતાનગર સોસાયટી ઇન્ડ્રજીત સોસાયટી સામે નિકોલ) એ તા.૩/૧૦/૧૮ નારોજ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૪/૧૮ સાજના ૭/૦૦ વાગ્યાના સુમારે અજાણ્યો પુરૂષ દક્ષ પટેલના ઘરે આવી જણાવેલ કે આવી હુ સંદીપ જોષીનો મિત્ર છું અને સંદીપ જોષીએ મોકલ્યો છું અને મારે તમારો કેમેરો ભાડે લઈ જવાનો છે તેમ કહી વિશ્વાસમા લઈ દક્ષ પટેલનો કેનોન કંપની નો ૧૩૦૦-ડી મોડલ કેમેરો કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- એક દિવસ માટે ભાડે લઈ જઈ આજ દીન સુધી કેમેરો પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.જે.ખાંટ ચલાવે છે.

બેદરકારીના લીધે મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૯૩૯/૧૮

નારોલ: વિક્રમભાઈ હરજીતભાઈ ગોપેલ (રહે.અતિથી એવેન્યુ, વેદીકા રેસીડેન્સી સામે નારોલ) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે અતિથી એવેન્યુના મુખ્ય દરવાજાનું બાંધકામ નબળું હોઈ અતિથી એવેન્યુના બીલ્ડર (૧) ગુણવત્તાભાઈ શાહ (૨) આશીર્વાદભાઈ શાહ (૩) આકાશભાઈ શાહ અને (૪) પરાગભાઈ શાહ નાઓને દરવાજા બાબતે અવાર-નવાર જાણ કરેલ છતાં દરવાજો રિપેરીંગ કે બાંધકામ નહી કરાવી બેદરકારીના લીધે તા.૦૨/૧૦/૧૮ સાજના ૬/૦૦ વાગ્યાના સુમારે ફ્લેટના છોકરાઓ મેઇન ગેટના આગળ ત્રણ ચાર નાના છોકરાઓ રમતા હતા ત્યારે ફ્લેટનો લોખંડનો મેઇન ગેટ દિવાલ સાથે નાના છોકરાઓ પર પડતા વિક્રમભાઈ હરજીતસિંહ ગોહેલના પુત્ર અનુજ (ઉ.વ.૪) ને ગંભીર ઈજાઓ થતા વા.સા.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૮/૧૦ વાગે તેનું મૃત્યુ નિપજયું હતું. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.બી રાહોડ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૯૪૦/૧૮

આનંદનગર: પ્રિતીબહેન વા/ઓ પંકજભાઈ ખત્રી (ઉ.વ.૩૮) (રહે. નિરાલી ફ્લેટ વસ્ત્રાપુર રેલ્વે ફાટક પાસે વેજલપુર) એ અગમ્ય કારણસર તા.૩/૧૦/૧૮ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.કે.બારડ ચલાવે છે.

મેઘાણીનગર: કામનીબહેન ભોયુ દયાનંદ તિવારી (ઉ.વ.૨૫) (રહે. જય ખોડીયારનગર ખુભાજીની ચાલી પાસે રામેશ્વર મેઘાણીનગર) એ અગમ્ય કારણસર તા.૩/૧૦/૧૮ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની પાઈપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નવનીતકુમાર હસમુકખલાલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.